

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને આદિવાસી વિસ્તારમાં કાર્યરત ઉચ્ચાન સંસ્થાના સહયોગથી ખેડૂતની આવક વધારવામાં પશુપાલનના યોગદાન અંગે એક-દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

ખેતી સાથે પશુપાલન એક પૂરક વ્યવસાય તરીકે સ્વીકારી પોતાના નાના-નાના ટુકડાઓમાં વહેંચાયેલ જમીનમાંથી ઉત્પાદિત અનાજ તથા ઘાસચારા દ્વારા લગભગ ૬૦ થી ૭૦ ટકા ગ્રામ્ય કુટુંબો પોતાનું જીવન ગુજારે છે. તેમાંથી પંચમહાલ તેમજ દાહોદ જેવા ટ્રાયબલ એરીયામાં પથરાળ જમીન, વરસાદ આધારિત ખેતીના કારણે લોકો ગુજરાન ચલાવવા સ્થળાંતર થઈ ખેડા, આણંદ જિલ્લામાં આવી જતા હોય છે. તેના બદલે ખેતી સાથેના પશુપાલનના વ્યવસાયને વૈજ્ઞાનિક ઢબે અપનાવી ટ્રાયબલ વિસ્તારની બહેનો પણ પુરુષો સાથે કુટુંબને સહાયક બનાવવામાં મદદરૂપ બને તે સમયની માંગ છે. તેથી કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય ખાતે તા.૨૭/૦૮/૨૦૧૯ શુક્રવારના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) સેલ તેમજ આદિવાસી વિસ્તારમાં કાર્યરત ઉચ્ચાન સંસ્થાના સહયોગથી તા. લીમખેડા જી. દાહોદની પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ બહેનો માટે એક દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ કાર્યક્રમના ઉદઘાટક ડૉ. કે. એસ. જાદવ દ્વારા પશુપાલન તાલીમની ઉપયોગીતા વિષેની માહિતી આપી તથા WTO સેલ અંતર્ગત યોજવામાં આવતા વિવિધ તાલીમ કાર્યક્રમ અંગેની જાણકારી સાથે વિભાગની અન્ય પ્રવૃત્તિઓનું વર્ણન કર્યું.

પ્રાસંગિક ઉદબોધનમાં ડૉ. ડી. સી. પટેલ, સહ પ્રાધ્યાપક દ્વારા તાલીમનું મહત્વ અને તેના દ્વારા થતા ફાયદાઓની જાણકારી આપી.

તાલીમમાં વેટરનરી કોલેજના વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા વિભિન્ન વિષયો ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યાં. જેમાં ડૉ. આર. જે. મોદી દ્વારા આદર્શ ઘેટાં બકરા પાલન, ડૉ. ડી. સી. પટેલ દ્વારા વિવિધ સંવર્ગની ગાય-ભેંસો માટે આહાર અને પશુપોષણ વ્યવસ્થા, ડૉ. જી. સી. મંડલી દ્વારા પશુઓના સામાન્ય રોગો, ઉપચાર અને અટકાયતી ઉપાયો અંગેની સમજ આપી. આ સાથે કૃષિ અને સંલગ્ન માહિતી પુસ્તિકાઓ અને તેના પ્રાયોગિક નિદર્શન અર્થે તાલીમાર્થીઓને કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યાં હતાં. થીયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી પશુ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., આણંદની મુલાકાત લીધી. તેમાં મીલ્કિંગ મશીન નિદર્શન કરાવવામાં આવ્યું. અંતે તાલીમ કો-ઓર્ડિનેટર શ્રી જિજ્ઞેશ મેકવાન દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

